



VIDHYAYANA

ISSN 2454-8596

[www.vidhyayanaejournal.org](http://www.vidhyayanaejournal.org)

An International Multidisciplinary Referred E-Journal

સૌરાષ્ટ્ર ક્ષેત્રની ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની

ફરિયાદ નિવારણની કામગીરીનો અભ્યાસ



ડૉ. આર. જી. ભુવા

પ્રિન્સીપાલ,

સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,

બરવાળા.



VIDHYAYANA

ISSN 2454-8596

[www.vidhyayanaejournal.org](http://www.vidhyayanaejournal.org)

## An International Multidisciplinary Referred E-Journal

### અમૂર્તિ:

આધુનિક યુગમાં ઔદ્યોગિક કાંતિ બાદ ઉદ્યોગોનો વિકાસ ખૂબજ જડપથી થતો જોવા મળ્યો છે. સ્થાનિક બજાર હવે વૈશ્વિક બજાર જેવું બનવા લાગ્યું છે ત્યારે ઉદ્યોગો વચ્ચે હરિફાઈનો ગેરલાભ ગ્રાહકોએ ભોગવવા પડે છે. ગ્રાહક એ બજારનો રાજા ગણાય છે પરંતુ આ વાત માત્ર પુસ્તકોમાં જ જોવા મળે છે વાસ્તવિક પરિસ્થિતિ વિપરિત છે ગ્રાહકોનું અવનવી રીતે વેપારીઓ દ્વારા શોષણ થતું આવ્યું છે અને થાય પણ છે. આ શોષણ ને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે ઉપરાંત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ગ્રાહકોના કલ્યાણ માટે સ્વૈચ્છાએ કાર્ય કરવા અસ્તિત્વમાં આવી છે. તેથી સંશોધનકારે પસંદ કરેલી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી માપવા માટે પ્રયાસ કર્યો છે. આ સંશોધન પેપરનો મુખ્ય ઉદ્દેશ એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણ અંગેની કામગીરીની તપાસ કરવાનો છે. સંશોધનકારે ઉદ્દેશો અને પૂર્વધારણાઓના પરીક્ષણના હેતુથી એકાઉન્ટિંગ અને આંકડાકિય સાધનોનો ઉપયોગ કર્યો છે. માહિતીના વિશ્લેષણ માટે અનોવા એફ-ટેસ્ટનો ઉપયોગ કરી અર્થઘટન કરવામાં આવ્યું છે.

ક્રિ-વર્ક : ઔદ્યોગિક કાંતિ, ગ્રાહક, સ્વૈચ્છિક સંસ્થાઓ

VIDHYAYANA



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Referred E-Journal

### 1. પરિચय

ભારત દેશનો ઝડપી વિકાસ કરવા માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી જેના દ્વારા સમાજ કલ્યાણ કરી દેશનો ઝડપી વિકાસ કરી શકાય. સમાજ કલ્યાણ માટેની કામગીરી સરકારી સંસ્થાઓ દ્વારા થાય છે. પરંતુ દેશના વધુને વધુ નાગરિકો સુધી લાભ પહોંચાડવા માટે સરકારી સંસ્થાઓ સાથે સાથે સૈચિદ્ધક સંસ્થાઓની પણ જરૂરિયાત રહેલી છે. તેથી આજાઈ પછી સૈચિદ્ધક સંસ્થાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

સૈચિદ્ધક સંસ્થાઓને સરકારી સહાય પણ મળતી હોવાથી તેમની વૃદ્ધિ અને વિકાસ વધુ પ્રમાણમાં થયેલો જોવા મળે છે. સૈચિદ્ધક સંસ્થાઓનો વિકાસ એ સમાજ માટે ફાયદાકારક બાબત છે. સમય જતાં સૈચિદ્ધક સંસ્થાઓ ગામ અને શહેરથી આગળ વધીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી થઈ છે. ગ્રાહકોના પ્રશ્નો અને તેમનું શોખણ દિવસે દિવસે વધતું જાય છે ત્યારે સૈચિદ્ધક સંસ્થાઓની જવાબદારી પણ વધતી જાય છે. સૈચિદ્ધક સંસ્થાઓ ગ્રાહકોની ફરિયાદોની નોંધ કરી તેનું નિરાકરણ કરવાની પ્રવૃત્તિ કરે છે.

સૈચિદ્ધક ગ્રાહક સંગઠન એ ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહન આપવા તેમજ સુરક્ષિત કરવા માટે રચાયેલ ગ્રાહકોનું સંગઠન છે. ગ્રાહક સંગઠન ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન કરે છે, ગ્રાહક શોખણ સામે લડે છે, ગ્રાહકોના હિતોની રક્ષા કરે છે, ગ્રાહક શિક્ષણ આપે છે, ગ્રાહક જાગૃતિ વધે તેવા પ્રયાસો હાથ ધરે છે. મોટા ભાગની સૈચિદ્ધક સંસ્થાઓ જાહેર હિત માટે કાર્ય કરતી હોય છે, ત્યારે આ સંસ્થાઓ સામાજિક જવાબદારી નિભાવી રહી છે તેવું ચોક્કસપણે કહી શકાય. ગ્રાહકલક્ષી શિક્ષણથી લોકો અજાણ હોય છે તેથી અજાણતાને કારણે ગ્રાહકોને શોખણ થતું જોવા મળે છે. સૈચિદ્ધક ગ્રાહક સંસ્થાઓ ગ્રાહકલક્ષી શિક્ષણ દ્વારા ગ્રાહકોને જાગૃત કરે છે. સૈચિદ્ધક ગ્રાહક સંસ્થાઓ ગ્રાહકોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ હોય છે જે—તે વિસ્તારમાં આવી સંસ્થાઓની કામગીરી ખૂબજ પ્રશંસનીય રહી છે. આ સંસ્થાઓ પોતાના કાર્યથી પ્રચલિત થતી જોવા મળી છે, સમાજને આવી સંસ્થાઓનો લાભ મળતા ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી છે ત્યારે અંતિમ લાભ ગ્રાહકોને પ્રાપ્ત થતા ગ્રાહકોના શોખણનું પ્રમાણ ઘટયું છે. ગ્રાહકોને ન્યાય અપાવવાની જવાબદારી જ્યારે સૈચિદ્ધક ગ્રાહક સંસ્થાઓ પર આવી છે ત્યારે આવી સંસ્થાઓ અગ્રેસર રહી પોતાની જવાબદારીને પૂર્ણ નિષ્ઠાથી નિભાવી રહી છે.

### 2. સાહિત્યની સમીક્ષા

(૧) અમરજીત લાલ (૨૦૧૩) એ "ગ્રાહકોની સમસ્યા હલ કરવામાં એનજાઓની ભૂમિકા : હમીરપુર ગ્રાહક સુરક્ષા સંગઠનનો કેસ અભ્યાસ" હાથ ધર્યો હતો. જે ગ્રાહકોના અધિકારોના મહત્વ અને ગ્રાહકોના રક્ષણમાં એનજાઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા પર ભાર મૂકે છે. સંશોધનકારે હમીરપુર ગ્રાહક સુરક્ષા સંગઠન દ્વારા કરવામાં



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Referred E-Journal

આવેલ કાર્યનું મૂલ્યાંકન કર્યું છે અને એવા કેટલાક કિસ્સાઓને પ્રકાશિત કર્યા છે કે જ્યાં ગ્રાહકના અધિકાર વ્યતિગત રૂપે સુરક્ષિત છે. સંસ્થાને લોકોમાં જાગૃતિ લાવવા બદલ વર્ષ ૧૯૮૬-૮૭ માં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. કેસ સ્ટડીમાં દર્શાવેલા કેસ ગ્રાહકોના અધિકાર પ્રત્યે લોકોના મનોબળને વેગ આપશે.

- (૨) વ્યાસ એચ.ડી. (૨૦૦૩) ના અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહક સુરક્ષા ચળવળમાં ભાવનગર જિલ્લાની સૈચિદ્ધક સંસ્થાઓની ભૂમિકાનું વિશ્લેષણ કરવાનો છે. જેમાંથી મોટા ભાગની સંસ્થાઓ ગ્રાહક સુરક્ષા, ગ્રાહક શિક્ષણ, જાગૃતિ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે, તેમાંથી કેટલીક સંસ્થાઓ પાસે પોતાના સંશોધનો છે, જ્યારે કેટલીક સંસ્થાઓ 'અન્ય દાન' દ્વારા મેળવેલા સંસાધનો ધરાવે છે. સંશોધનકારે જણાવ્યું હતું કે જિલ્લામાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ યોગ્ય રીતે ચાલી રહી છે પરંતુ લોકોનું સમર્થન, ગ્રાહક સુરક્ષા અધિનિયમ વિશેનું જ્ઞાન અને ગ્રાહકોને તેમના અધિકાર પ્રાપ્ત કરવાની તૈયારી ઓછી છે. અંતે તેમણે તારણોમાં રજુ કર્યું કે ફોરમમાં કેસના નિરાકરણમાં વિલંબ, સરકારી કચેરીઓમાં અપૂર્તતા આર્થિક સાધનો અને અસહકારી વલણ એ સમસ્યાઓ છે જે સંગઠનોની સ્થિતિને નબળી પાડે છે.

### ૩. ઉદ્દેશો

- (૧) સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી સૈચિદ્ધક સંસ્થાઓની કામગીરીનું માપન કરવું.
- (૨) ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી સૈચિદ્ધક સંસ્થાઓમાં થતી ફરિયાદોના નિવારણ અંગેની તપાસ કરવી.
- (૩) ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી જુદી જુદી સૈચિદ્ધક સંસ્થાઓમાં થતી ફરિયાદોના નિવારણની માહિતીની તુલના કરવી.

### ૪. માહિતી સંગ્રહ અને અભ્યાસનો સમયગાળો

#### માહિતી સંગ્રહ :

આ સંશોધન અભ્યાસ માટે વિવિધ સૈચિદ્ધક સંસ્થાઓ પાસેથી પ્રશ્નાવલી દ્વારા માહિતી એકઠી કરવામાં આવી છે.

#### અભ્યાસનો સમયગાળો :

સૈચિદ્ધક સંસ્થાઓની કામગીરીને માપવા માટે અભ્યાસનો સમયગાળો ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી પાંચ વર્ષનો છે.



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Referred E-Journal

### ५. पूर्वधारणा

H<sub>0</sub> : ग्राहक सुरक्षा क्षेत्रे कार्य करती जूदी जूदी स्वैच्छिक संस्थाओंनी फरियाद निवारण वर्च्ये कोई तक्षावत नाथी.

H<sub>1</sub> : ग्राहक सुरक्षा क्षेत्रे कार्य करती जूदी-जूदी स्वैच्छिक संस्थाओंनी फरियाद निवारण वर्च्ये तक्षावत छे.

### ६. साधनो अने तकनीको

अही संशोधनकारे माहितीना विश्लेषण अने अर्थाघटन माटे एकाउन्टिंग अने आंकडाकिय साधनोनो उपयोग कर्यो छे. पूर्वधारणा परीक्षण माटे वपरायेल अनोवा एफ-टेस्ट.

### ७. माहितीनुं विश्लेषण

:: कोष्टक - १ ::

#### पसंद करेली जूदी जूदी स्वैच्छिक संस्थाओंनी फरियाद निवारणानुं प्रमाण

वर्ष	राजकोट		भावनगर		बोटाइ		अमरेली		गीर सोमनाथ		जुनागढ	
	संख्या	टका (%)	संख्या	टका (%)	संख्या	टका (%)						
2015	426	92.81	99	94.29	249	97.27	243	97.59	548	91.79	210	88.24
2016	483	94.71	107	95.54	258	96.27	254	99.22	583	91.38	205	89.52
2017	394	88.94	100	92.59	250	96.53	295	98.99	577	91.88	200	88.89
2018	491	92.82	115	94.26	266	97.79	264	99.62	567	99.47	223	89.2
2019	447	91.22	114	96.61	278	97.54	285	98.28	573	92.87	207	89.22

ग्राहक सुरक्षा मंडळनी मुख्य कामगीरी ग्राहकोनी फरियादोनुं निवारण मेणववानुं छे. वर्ष २०१५ मां राजकोट जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८२.८१%, भावनगर जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८४.२८%, बोटाइ जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८७.२७%, अमरेली जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८७.५८%, गीर सोमनाथ जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८१.७८% अने जुनागढ जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८८.२४% फरियादोनुं निवारण थयुं हतुं. वर्ष २०१६ मां राजकोट जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८१.२२%, भावनगर जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८६.६१%, बोटाइ जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८७.५४%, अमरेली जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८८.२८%, गीर सोमनाथ जिल्लानी संस्थामां थयेली कुल फरियादोना ८२.८७%, अने जुनागढ जिल्लानी संस्थामां



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Referred E-Journal

થયેલી કુલ ફરિયાદોના ૮૮.૨૨% ફરિયાદોનું નિવારણ થયું હતું. વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૧૯ સુધી સૌથી વધુ ફરિયાદોનું નિવારણ અમરેલી જિલ્લાની સંસ્થા દ્વારા અને સૌથી ઓછી ફરિયાદોનું નિવારણ જુનાગઢ જિલ્લાની સંસ્થા દ્વારા થયું હતું.

$H_0$  : ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણ વચ્ચે કોઈ તફાવત નથી.

$H_1$  : ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણ વચ્ચે તફાવત છે.

### પસંદ કરેલી જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણ માટે અનોવા ટેબલ

સ્ત્રોત	વર્ગોના સરવાળા	સ્વાતંત્ર્ય સંખ્યા	વિચરક એમ. એસ.	અફ મૂલ્ય	દી મૂલ્ય	અફ નિર્ણાયક મૂલ્ય
જૂથો વચ્ચે	710639.4	5	142127.9	335.81	2.18E-21	2.62
જૂથો અંતર્ગત	10157.6	24	423.2			
કુલ	720797	29				



ઉપરોક્ત ટેબલ વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ ના સમયગાળા માટે પસંદ કરેલી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણની નોંધપાત્ર તફાવતની તપાસ માટે વન વે અનોવા વર્ગીકરણ બતાવે છે. અફ-પરીક્ષણ ૫% નોંધપાત્ર લેવલ અને (૫, ૨૪) (સી, આર) ડિગ્રી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને કરે છે.

અનોવા એફ-ટેસ્ટ તપાસ કરે છે કે અભ્યાસના સમયગાળા દરમિયાન પસંદગીની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણમાં નોંધપાત્ર તફાવત છે કે નહીં. અહીં શૂન્ય ઉત્કલ્પના એ છે કે પસંદ કરેલ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણ વચ્ચે કોઈ તફાવત નથી. જે ૦.૦૫% નોંધપાત્ર લેવલે તપાસવામાં આવેલ છે.

એફ-પરીક્ષણ મૂલ્ય ઉત્પ.૮૧ છે જે ૫% લેવલ પર નોંધપાત્ર છે. એફ નિર્ણાયક મૂલ્ય ૨.૬૨ છે. એફ-પરીક્ષણ ઉત્કલ્પના સ્વીકૃતિ ક્ષેત્ર -૨.૬૨ થી +૨.૬૨ છે. અહીં એફ-પરીક્ષણ મૂલ્ય ઉત્પ.૮૧ સ્વીકાર્ય ક્ષેત્ર -૨.૬૨ થી + ૨.૬૨ ની વચ્ચે આવ્યું નથી જે સૂચવે છે કે ગણતરી કરેલ મૂલ્ય એફના ટેબલ મૂલ્ય કરતાં વધુ છે પરિણામે શૂન્ય ઉત્કલ્પનાને નકારી કાઢવામાં આવે છે. તેનો અર્થ એ કે વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ ની પસંદ કરેલી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણમાં નોંધપાત્ર તફાવત છે.



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Referred E-Journal

### ૮. પરિણામો

માહિતીના વિશ્લેષણ અને પૂર્વધારણા પરીક્ષણના આધારે મળેલા પરિણામ નીચે મુજબ છે.

- (૧) ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી દરેક સૈચિદ્ધક સંસ્થાઓમાં ફરિયાદ નિવારણ અંગેની ટકાવારી ૮૦% આસપાસ જોવા મળી છે.
- (૨) ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી દરેક સૈચિદ્ધક સંસ્થાઓની ફરિયાદ નિવારણમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે.
- (૩) જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાની સરખામણીએ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની સંસ્થામાં ફરિયાદ નિવારણનું પ્રમાણ વધુ જોવા મળે છે.

### ૯. નિષ્કર્ષ

ગ્રાહકોને રક્ષણ પ્રાપ્ત થાય અને તેના અધિકારોની જાણકારી દ્વારા શોષણાનું પ્રમાણ ઘટે તે હેતુથી ગ્રાહક સુરક્ષા ધારો—૧૯૮૬ અસરકારક રીતે લાગુ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોનું શોષણ અટકાવવા માટે સૈચિદ્ધક સંસ્થાઓ કાર્યરત છે. સૈચિદ્ધક સંસ્થાઓ જે તે વિસ્તારમાં ગ્રાહકોને તેમના અધિકારો અને ફરજો અંગે શિક્ષિત બનાવે છે, સંસ્થામાં થયેલી ફરિયાદોનું ઝડપી નિવારણ લાવે છે, ઉપરાંત ગ્રાહક જાગૃતિ વધે તેવા પ્રયત્નો પણ હાથ ધરે છે. સૈચિદ્ધક સંસ્થાઓની કામગીરીનો લાભ સમાજને પ્રાપ્ત થાય છે.

VIDHYAYANA

### ૧૦. સંદર્ભ

- (૧) અગ્રવાલ એમ. (૨૦૦૬) ભારતમાં ગ્રાહક વર્તણૂક અને ગ્રાહક સુરક્ષા. નવી દિલ્હી, નવી સાઢી પબ્લિકેશન્સ.
- (૨) સી. એચ. રવિ કુમાર, ડૉ. ડી. નાગેશ્વર રાવ, ડૉ. એમ. એસ. નારાયણ, "ગ્રાહક સુરક્ષામાં એનજીઓની ભૂમિકા" આઈ જે આઈ આર એસ. ટી, ફેબ્રુઆરી ૨૦૧૫, ભાગ-૪, અંક-૨.
- (૩) કોઠારી, સીઆર (૨૦૦૭) સંશોધન પદ્ધતિ, પદ્ધતિઓ અને તકનીકો. નવી દિલ્હી, ભારત : ન્યૂ એજ ઇન્ટરનેશનલ (પી) લિ.
- (૪) <http://www.google.co.in>